



ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોએ એપ્રિલ 3 થી સમગ્ર પોવિન્સમાં શટડાઉનની ઘોષણા કરી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 1, 2021) – આજે, ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોએ એપ્રિલ 3, 2021 થી શરૂ કરીને સમગ્ર પ્રોવિન્સને આવરી લેતા શટડાઉનની ઘોષણા કરી, જે રીજીયન ઓફ પીલ સહિતના ઓન્ટેરિયો માટે ઓછામાં ઓછાં ચાર અઠવાડિયાઓ સુધી અમલમાં રહેશે.

સુરક્ષા ઉપાયોમાં નીચેની બાબતો સામેલ છે, પરંતુ માત્ર એટલી જ સીમિત નથી:

- ઈનડોર જાહેર આયોજનો અને સામાજિક મેળાવડા કરવાની મનાઈ છે; એકલી રહેતી વ્યક્તિને અન્ય એક કુટુંબીજન સાથે ભેગા થવાની પરવાનગી મળે છે;
- આઉટડોર જાહેર આયોજનો કે સામાજિક મેળાવડા માટેની ક્ષમતા મહત્તમ 5-વ્યક્તિ સુધી સીમિત છે, એકજ ઘરમાં રહેતા સભ્યો (તમે રહેતા હો તે લોકો) સાથે ભેગા થાવ તે સિવાય;
- બધી રિટેઇલ સગવડોમાં રૂબરૂમાં ખરીદી મર્યાદિત રહેશે, 50 ટકા સુધીની ક્ષમતા સીમા સુપરમાર્કેટ્સ, ગ્રોસરી સ્ટોર્સ, કન્વેનિયન્સ સ્ટોર્સ, ઈનડોર ફાર્મર્સ માર્કેટ્સ, અને મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ વેચતા અન્ય સ્ટોર્સ માટે, અને 25 ટકા સુધીની ક્ષમતા સીમા મોટા બોક્સ સ્ટોર્સ સહિતની અન્ય રિટેઇલ સગવડો માટે રહેશે, સાથે સાથે અન્ય જાહેર આરોગ્ય અને કાર્યસ્થળે સુરક્ષા ઉપાયો અમલી રહેશે;
- અંગત સંભાળ સેવાઓ બંધ રહેશે;
- ઈનડોર અને આઉટડોર ડાર્નિંગ પર પ્રતિબંધ ફરમાવેલ છે. રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને અન્ય ખાદ્ય પદાર્થો કે પીણાં વેચતી સગવડોને માત્ર ટેક-આઉટ, ડ્રાઇવ-થ્રુ, અને ડિલિવરી દ્વારા સંચાલિત કરવાની પરવાનગી રહેશે;
- ઈનડોર કે આઉટડોર સ્પોર્ટ્સ અને રિક્રિએશનલ ફિટનેસ (દા.ત. જીમ્સ) માટે સગવડોનો ઉપયોગ બહુ સીમિત અપવાદો સાથે પ્રતિબંધિત રહેશે;
- ડે કેમ્પ્સ (દિવસની શિબિરો) બંધ કરવી જરૂરી બની છે; અને,
- લગ્ન સમારોહ, અંતિમક્રિયા, અને ધાર્મિક સેવા, ધાર્મિક વિધિઓ કે ઉત્સવોમાં ક્ષમતા ઈનડોર રૂમ દીઠ 15 ટકા વ્યક્તિઓ સુધી, અને આઉટડોર્સમાં વ્યક્તિઓ વચ્ચે બે મીટરનું ભૌતિક અંતર જાળવી શકાય તેટલી વ્યક્તિઓની સંખ્યા જાળવવાની રહેશે. આમાં આ સેવાઓ સાથે સંકળાયેલા સામાજિક મેળાવડાનો સમાવેશ થતો નથી જેમ કે રિસેપ્શન્સ, જેને ઈનડોર્સ પરવાનગી આપેલી નથી અને આઉટડોર્સમાં ક્ષમતા પાંચ લોકો સુધી સીમિત રહેશે.

ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની સલાહ પ્રમાણે, રહેવાસીઓને ઘર બહારનો પ્રવાસ જરૂરિયાતોને પહોંચી વળવા સુધી સીમિત રાખવાનું કહેવામાં આવ્યું છે જેમ કે ખાદ્ય પદાર્થો, દવાઓની ખરીદી, તબીબી એપોઈન્ટમેન્ટ્સ, નબળા સામુદાયિક સભ્યોને સહાયરૂપ થવા માટે, અથવા પોતાના કુટુંબીજનો સાથે આઉટડોર્સ કસરત કરવી. બધાં ઉદ્યોગોના એમ્પ્લોયર્સે કર્મચારીઓ ઘરે બેઠા કામ કરી શકે તે માટે દરેક પ્રયત્ન કરવો જોઈએ.

સીટી સર્વિસીસ અને ફેસિલિટીસ

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો

સીટી હોલ અને કોર્પોરેટ સગવડો રૂબરૂ સેવાઓ માટે માત્ર એપોઈન્ટમેન્ટથી ચાલુ રહેશે. વોક-ઇન્સને પરવાનગી નથી. એપોઈન્ટમેન્ટ બૂક કરાવવા, વેબસાઈટ જુઓ www.brampton.ca/skiptheline.

સીટી રિક્રિએશન સેન્ટર્સ

સીટી ઓફ બ્રેમ્પટનની બધી મનોરંજનલક્ષી સગવડો જાહેર જનતા માટે બંધ રહેશે અને ઈનડોર પ્રોગ્રામ્સ આગળ નોટિસ આપતા સુધી રદ રહેશે.

વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સ

વર્ચ્યુઅલ ફિટનેસ

રહેવાસીઓને તાલીમબદ્ધ ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર્સ સાથે ઈન્સ્ટ્રક્ટરની આગેવાનીમાં 30-મિનિટના મફત લાઇવ વર્કઆઉટ્સના વર્ચ્યુઅલ ફિટનેસ વર્ગોમાં સહભાગી થવા આમંત્રિત કરવામાં આવે છે.

55+ વર્કશોપ્સ

55 વર્ષ અને વધારે ઉંમરના બ્રેમ્પટનવાસીઓ પોતાના ઘરેથી વર્ચ્યુઅલ વર્કશોપ્સ માટે મફતમાં નોંધણી કરાવી શકે છે. સહભાગીઓ પાસે સુરક્ષિત અને સંરચિત વાતાવરણમાં સોશિયલાઇઝ થવાની, નવા મિત્રો બનાવવાની અને ઓનલાઇન જોડાવાની તક રહેશે.

સર્વગ્રાહી વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓ અને વર્કશોપ્સ

આ શ્રેણી અશક્તતા ધરાવતા અને અપવાદમય સહભાગીઓ માટે પ્રવૃત્તિઓમાં જોડાવાની, કંઈક નવું શીખવાની અને સમોવડિયાઓ સાથે સ્થાયી મિત્રતા બનાવવાની ચડિયાતી તક છે.

નોંધણી કેવી રીતે કરવી તે સહિત, વર્ચ્યુઅલ પ્રોગ્રામ ઓફર્સ સંબંધમાં વધુ માહિતી વેબસાઇટ www.brampton.ca/recreation પર ઓનલાઇન જોઈ શકાય છે.

રેક એટ હોમ (Rec At Home)

ઘરે બેઠાં સ્વ-માર્ગદર્શક ઓનલાઇન આર્ટ્સ અને ક્રાફ્ટ ટ્યુટોરિયલ્સ સાથે સક્રિય અને પ્રવૃત્તમય રહો, 24/7 પહોંચ સુલભ! ઓરિગામી હાર્ટ્સ બનાવવાની રીત શીખો, તમારી કેલિગ્રાફી આવડતો, અને ઘણાં બધાંનો મહાવરો કરો. વિવિધ રેક એટ હોમ પ્રવૃત્તિઓમાં [અહીંથી](#) પ્રવેશો, તેને બ્રેમ્પટન રિક્રિએશને પ્રેમપૂર્વક બનાવી છે.

બ્રેમ્પટન લાઇબ્રેરી

બ્રેમ્પટન લાઇબ્રેરી માત્ર ચિંગકુસી, ફોર કોર્નર્સ, અને સિંગરોડેલ શાખા પુસ્તકાલયોમાં સીમિત બ્રાંચ સેવાઓ આપે છે. સીરિલ ક્લાર્ક, ગોર મીડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, સાઉથ ફ્લોયર્સ અને સાઉથ વેસ્ટ શાખા પુસ્તકાલયોમાં કર્બસાઇડ પિકઅપ ઉપલબ્ધ છે. હાલમાં સંચાલન ક્લાકો, સુરક્ષા પ્રોટોકોલ્સ, અને પુસ્તકો કેવી રીતે રાખી મૂકવા (હાઉ ટૂ પ્લેસ હોલ્ડ્સ) માટે [અહીં ક્લિક કરો](#). હાલમાં, બ્રાંચ સેવાઓમાં માત્ર હોલ્ડ્સ પિકઅપ, લેવડદેવડ હેતુસર લાઇબ્રેરી કોમ્પ્યુટર્સનો સીમિત ઉપયોગ દિવસ દીઠ મહત્તમ એક ક્લાક માટે, અને સીમિત પ્રિન્ટિંગ અને ફોટોકોપી સેવાઓનો સમાવેશ થાય છે. આ સમયે બ્રાંચમાં અભ્યાસ માટે જગ્યા (સ્ટડી સ્પેસ) ઉપલબ્ધ નથી અને કામ કે અભ્યાસ કરવા અંગત સાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. કર્મચારીઓની પસંદગીની લાઇબ્રેરી મટીરિયલ્સની ગ્રેબ એન્ડ ગો (Grab'n' Go) બેગ્સને લક્ષમાં લો અને બધી શાખાઓમાં 24-ક્લાક બાહ્ય ડ્રોપ બોક્સીસ મારફતે મટીરિયલ્સ સુરક્ષિત રીતે અને સહેલાઈથી પરત કરો. ઓવરડ્યુ દંડ આગળ નોટિસ આપતા સુધી વસૂલવામાં આવશે નહીં.

લિંક્સ (કડીઓ)

વધુ માહિતી મેળવો:



- [સીટી ઓફ બ્રમ્પટન COVID-19 પ્રોગ્રામિંગ અને સર્વિસ અપડેટ્સ](#)
- [સીટી ઓફ બ્રમ્પટન – શું ખુલ્લું છે, શું બંધ છે](#)
- [COVID-19 લક્ષણો](#)
- [COVID-19 વેક્સીન \(રસી\)](#)
- [બ્રમ્પટનમાં ટેસ્ટિંગ](#)
- [સેલ્ફ-આઈસોલેટ કેવી રીતે થવું](#)
- [COVID-19 દરમિયાન ધંધાઓ અને કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા](#)
- [પીલમાં COVID-19 નાં કેસીસ](#)

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca